



* J G - 0 0 0 2 - 0 1 6 1 4 *

JG-002-001614 Seat No. _____

B. Com. (Sem. VI) (CBCS) Examination

August - 2019

Advance Statistics - 6

(Old Course) (Economic Statistics)

Faculty Code : 002

Subject Code : 001614

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70]

- સૂચના : (૧) બધા જ પ્રશ્નો ફરજિયાત છે.
 (૨) જમણી-બાજુએ પ્રશ્નના ગુણ દર્શાવેલા છે.
 (૩) કેલક્યુલેટરનો ઉપયોગ કરવાની ધૂટ છે.

૧ સમજાવો : ૨૦

- (અ) બજાર સમતોલપણું
 (બ) માંગનો નિયમ અને પુરવઠાનો નિયમ
 (ક) આમદાની વક
 (ઢ) માંગની મૂલ્યસાપેક્ષતા.

અથવા

૧ (અ) $\eta = \frac{A \cdot R}{A \cdot R - M \cdot R}$ સાબિત કરો. ૧૦

(બ) એક ઈજારદારનું માંગ-વિધેય $x = 30 - 2p$ છે અને ખર્ચ વિધેય ૧૦

$$c = -30 + 4x + \frac{x^2}{20} \text{ છે તો ઈજારદારનો મહત્તમ નક્કી શોધો.}$$

૨ (અ) ઈજારો અને બે વસ્તુઓનું ઉત્પાદન વિશે ટૂંક નોંધ લખો. ૧૦
 (બ) પુરવઠાની મૂલ્યસાપેક્ષતા અને ખર્ચની મૂલ્યસાપેક્ષતા સમજાવો. ૧૦

અથવા

૨ (અ) એક વસ્તુના ઉત્પાદન માટેનું કુલ ખર્ચ વિધેય $K = \frac{24}{x} + \frac{3x}{2} + 5$ હોય તો ૧૦

ઉત્પાદકનું ન્યૂનતમ ખર્ચ શોધો.

(બ) માંગનું વિધેય એક વસ્તુ માટે $P = \frac{7500 - x^2}{100}$ હોય તો મહત્વમાં ૧૦

આમદાની માટે કિંમત શોધો તેમજ મહત્વમાં આમદાની શોધો ઉપરાંત કુલ આમદાની વક્ત દોરો.

- ૩ (અ) નીપજક-નીપજ પૃથક્કરણાના ફાયદાઓ જણાવો તેમજ તેની મર્યાદાઓ પણ ૮
જણાવો.
(બ) બે ઉદ્યોગ માટે નીપજક-નીપજ પૃથક્કરણ સમજાવો. ૭

અથવા

- ૩ ગ્રાણ ઉદ્યોગનો તાંત્રિક અંકોની શ્રેષ્ઠિક નીચે પ્રમાણે છે ૧૫

$$A = \begin{bmatrix} 0.2 & 0.2 & 0.1 \\ 0.2 & 0.5 & 0.2 \\ 0.4 & 0.4 & 0.5 \end{bmatrix}$$

જો છેવટની માંગ ગ્રાણેય ઉદ્યોગ માટે અનુક્રમે 10, 20 અને 30 થાય તો ગ્રાણેય ઉદ્યોગનાં કુલ ઉત્પાદન શોધો.

- ૪ (અ) સમજાવો : કુલ તુલ્લિગુણ અને સીમાન્ત તુલ્લિગુણ, સરેરાશ ઉત્પાદન અને સીમાન્ત ઉત્પાદન.
(બ) યુલરનું પ્રમેય લખો અને સાબિત કરો. ૭

અથવા

- ૪ (અ) બજેટ સમીકરણને આધીન મહત્વમાં તુલ્લિગુણ શોધવાની રીત સમજાવો. ૮
(બ) એક ગ્રાહકનું તુલ્લિગુણ વિધેય $U = 24x + 48y - x^2 - y^2$ હોય અને તેનું બજેટ સમીકરણ $x + 3y = 14$ હોય તો મહત્વમાં તુલ્લિગુણ શોધો. ૭

ENGLISH VERSION

Instructions : (1) All questions are compulsory.
(2) Marks are indicated on right side.
(3) Use of calculator is allowed.

1 Explain : 20

- (a) Market Equilibrium
- (b) Demand Law and Supply Law
- (c) Revenue curve
- (d) Price Elasticity of Demand.

OR

1 (a) In usual notations prove that $\eta = \frac{A \cdot R}{A \cdot R - M \cdot R}$. 10
(b) If the demand function of a monopolist is

$$x = 30 - 2p \text{ and cost function is } c = -30 + 4x + \frac{x^2}{20},$$

find maximum profit.

2 (a) Explain : Monopoly and production of two commodities. 10
(b) Explain :
(i) Price Elasticity of Supply
(ii) Price Elasticity of Cost.

OR

2 (a) Find the minimum cost if total cost function is 10

$$K = \frac{24}{x} + \frac{3x}{2} + 5$$

- (b) If the demand function of a commodity is

$$p = \frac{7500 - x^2}{100}, \text{ find price for maximum revenue and}$$

also find the maximum revenue. Draw revenue curve.

- 3** (a) State advantages and limitations of Input-output analysis. **8**
 (b) Explain Input-output analysis for two industries. **7**

OR

- 3** The following is a technical coefficient matrix of three industries. **15**

$$A = \begin{bmatrix} 0.2 & 0.2 & 0.1 \\ 0.2 & 0.5 & 0.2 \\ 0.4 & 0.4 & 0.5 \end{bmatrix}$$

If the final demands are 33, 8 and 16 respectively for three industries, find total productions of three industries.

- 4** (a) Explain : Total Utility and Marginal Utility **8**
 Average Production and Marginal Production.
 (b) State and prove Euler's theorem. **7**

OR

- 4** (a) Explain method to find maximum utility subject to budget equation. **8**
 (b) The utility function of a consumer is **7**

$$U = 24x + 48y - x^2 - y^2 \text{ and his budget equation is}$$

$$x + 3y = 14. \text{ Find maximum utility.}$$
